

ત્વરિત જાહેરાત માટે

મતદાનને 100 દિવસ બાકી – તૈયાર છો?

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 જુલાઈ 2022) – સોમવાર, 24 ઓક્ટોબર 2022ના રોજ બ્રેમ્પટનના મતદારો નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચુંટણીઓમાં મતદાન કરી એક મહત્વપૂર્ણ નિર્ણય લેશે તે માટે રવિવાર જુલાઈ 17ના દિને 100 દિવસ બાકી રહેશે.

મતદાન સરળ છે – મતદારો માટે અહીં થોડીક સહાયક સૂચનાઓ આપીએ છીએ:

- **નિર્ધારિત કરો કે તમે ઉત્સવો ધરાવતા મતદાર છો:** તમે કેનેડાના નાગરિક હોવ, મતદાન દિવસના દિને તમે ઓછામાં ઓછા 18 વર્ષના હોવ અને બ્રેમ્પટનમાં રહેતા હોવ (અથવા બ્રેમ્પટનમાં જમીન માલિક અથવા ભાડુઆત છો કે એવા માલિક કે ભાડુઆતના જીવનસાથી હોવ) તો તમે મતદાન કરવા લાયક છો.
- **મતદાર યાદીમાં તમારી માહિતીની પુષ્ટિ કરો:** તમારી માહિતી સાચી અને અદ્યતન થયેલ છે કે કેમ તે ચકાસવા માટે અહીં મુલાકાત લો voterlookup.ca. આ વેબસાઈટ 21 જુલાઈ 2022 સુધી સક્રિય રહેશે. ત્યાર પછી, સપ્ટેમ્બર 1ના રોજથી મતદારો પોતાની માહિતી સિટીની વેબસાઈટ પર ચકાસી શકશે.
- **તમારા વોર્ડને જાણો:** તમે કયા વોર્ડમાં નિવાસ કરો છો તે અંગે તમને ખાતરી ન હોય તો [અહીં ચકાસો](#).
- **તમારા વોર્ડમાં કોઈ પણ સ્થળે મત આપો:** ઓક્ટોબર 24ના રોજ, તમે તમારા વોર્ડની અંદર કોઈ પણ સ્થળે મત આપી શકશો. મતદાન સ્થાનની માહિતી સપ્ટેમ્બરમાં સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.
- **એડવાન્સ વોટિંગ તારીખો:** જો તમે ઓક્ટોબરની 24ના રોજ ઉપલબ્ધ નથી, તો 7, 8, 9, 14 અથવા 15 ના રોજ કોઈ પણ એડવાન્સ મતદાનના દિવસોમાં મતદાન કરવાનું વિચારશો. એડવાન્સ માહિતી સપ્ટેમ્બરમાં સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. સમાજના એવા સભ્યો માટે પણ એડવાન્સ મતદાન સારો વિકલ્પ બની શકશે જેઓ દિવાળી અથવા બંદી છોડ દિવસ ઉજવવામાં વ્યસ્ત હોય કારણકે બન્ને તહેવારો આ વખતે મતદાન દિવસની તારીખે જ છે.
- **પ્રોક્સિ મતદાન:** જો તમે બ્રેમ્પટનના ઉત્સવો ધરાવતા મતદાર હોવ જેઓ મતદાનના દિવસે કે એડવાન્સ મતદાનના દિવસો પર ઉપલબ્ધ નહીં હશે, તો તમે કોઈપણ અન્ય ઉત્સવો ધરાવતા બ્રેમ્પટનના મતદારને નિયુક્ત કરી શકો છો જેઓ તમારા વતી મતદાન કરશે. એવી કોઈપણ વ્યક્તિ જેમનું નામ મતદાર યાદીમાં હોય અથવા ઉમેરવામાં આવ્યું હોય તેઓ પ્રોક્સિ તરીકે મતદાન કરી શકશે. પ્રોક્સિ મતદાન વિશે વધુ માહિતી સિટીની વેબસાઈટ પર થોડા સમયમાં ઉપલબ્ધ થશે.
- **હોમ વોટિંગ (ગૃહ મતદાન) સર્વિસ:** એવા પાત્રતા ધરાવતા મતદારો જેઓ પોતાની માંદગી, ઈજા કે વિકલાંગતાને કારણે ઘરની બહાર નીકળી શકે તેમ ન હોય તેઓ ઓક્ટોબર 11, 12 અને 13ના રોજ ઘરેથી મતદાન કરવાની સેવા માટે અરજી કરી શકે છે. પાત્રતાના માપદંડો પૂર્ણ કરતા હોય તેવી વ્યક્તિઓ માટે મર્યાદિત એપોઈન્ટમેન્ટો ઉપલબ્ધ થશે. સેવા અને એપોઈન્ટમેન્ટ વિશે વધુ માહિતી સિટીની વેબસાઈટ પર થોડા સમયમાં ઉપલબ્ધ થશે.

- પોતાનું ઓળખપત્ર સાથે લાવશો: મતદારોએ મત આપવા માટે તેમનું નામ અને બ્રેમ્પટનનું પાત્રતા ધરાવતું સરનામું દર્શાવતું કોઈપણ એક ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે. મતદાન પૂર્વે [ઓળખ માટેના સ્વીકાર્ય દસ્તાવેજો](#)ની યાદી જોઈ લેશો.

વધારાના સ્મૃતિપત્રકો:

- ચૂંટણીમાં કામ કરો: આજે જ મ્યુનિસિપલ ચૂંટણી કાર્યકર બનવા માટે અરજી કરો અને મતદાનના દિવસે વહીવટી અને ગ્રાહક સેવા કાર્યોમાં સહાય કરો. 2,000 કરતા વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના બ્રેમ્પટનના રહેવાસીઓને પસંદગી આપવામાં આવશે. નવી કુશળતા મેળવવાનો, શહેરના કર્મચારીઓને જાણવાનો અને તમારા સમુદાય સાથે જોડાવાનો આ એક અનુપમ અવસર છે.
- નોમિનેશન ડે: સંભવિત ઉમેદવારો શુક્રવાર, 19 ઓગસ્ટ, બપોરે 2 વાગ્યા સુધી તેમના નામાંકન કાગળો ફાઈલ કરી શકે છે. ઉમેદવારની પાત્રતા અને નામાંકન પ્રક્રિયા વિશેની માહિતી [અહીં](#) ઉપલબ્ધ છે.
- તૃતીય પક્ષ જાહેરાતો: સંભવિત તૃતીય પક્ષ જાહેરાતકર્તાઓ બ્રેમ્પટનમાં જાહેરાત આપવા માટે ઓક્ટોબર 21 સુધી રજીસ્ટ્રેશન ફાઈલ કરી શકશે. તૃતીય પક્ષ જાહેરાતો, પાત્રતાની જરૂરિયાતો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશેની માહિતી [અહીં](#) ઉપલબ્ધ છે.

2022 બ્રેમ્પટન નગરપાલિકા અને સ્કૂલ બોર્ડની ચૂંટણી અંગેની વધુ માહિતી મેળવવા માટે અહીં મુલાકાત

લો www.brampton.ca/bramptonvotes.

સુવાક્યો

"માર્ગો, ઉદ્યાનો, રિક્રિએશન અને પરિવહન જેવી મ્યુનિસિપલ સેવાઓ રહેવાસીઓના રોજિંદા જીવનનો ભાગ છે. મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં મતદાન એ તમારા શહેરને આકાર આપવાની એક મહત્વપૂર્ણ રીત છે, અને એડવાન્સ મતદાનના દિવસો, ગૃહ મતદાન અને તમારા વોર્ડમાં કોઈપણ સ્થળે મત આપવાની ક્ષમતાથી તમામ લોકોને સુવિધા પ્રદાન થાય છે. મ્યુનિસિપલ અને સ્કૂલના બોર્ડની ચૂંટણીઓને જ્યારે માત્ર 100 જેટલા દિવસો રહ્યા છે ત્યારે સુનિશ્ચિતપણે મત આપવાનું આયોજન જરૂરથી કરશો!"

- પીટર ફ્રે, સીટી ક્લર્ક એન્ડ રિટર્નિંગ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca



Media Release

मिडिया संपर्क (MEDIA CONTACT):

सीटी ओड् ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

multiculturalmedia@brampton.ca